

# BOULT EMERGES AS NO. 1 SMART HEARABLES BRAND


As consumers move towards smart hearables, a study by CyberMedia Research suggests that over two-thirds of users listen to audio devices for 1-3 hours daily. Besides, style and technology, majority of the users prioritise audio quality while buying a hearable device. Boulton emerges as the No. 1 brand.

Most preferred hearable brands (%)



## Users priority while purchasing hearable -

True Wireless Stereo (TWS) earbuds, neckband (%)



## Consumer preferences: TWS vs neckbands

Neckbands dominate Tier-2 cities with 67% preference.

Tier 1 cities favor TWS earbuds with 75% preference.



Source: CyberMedia Research

# How Arteta powered Arsenal to the brink of EPL championship triumph

SANDIP G  
New Delhi, May 13

**WEARING A BROAD** smile, Arsenal manager Mikel Arteta said before the game against Manchester United: "My brain tells me Arsenal are going to lift the trophy next Sunday." Winning the title is no longer in the hands of his team—for the dream to realise, his former employers, Manchester City have to spill points, at the home of Arsenal's caustic rivals Tottenham Hotspur, or more improbably, at Etihad against a directionless West Ham United. Two London clubs could combine to bring the title back to the capital, though Manchester looks the likelier destination.

But Arteta and Arsenal would not shed belief. That perhaps is the biggest virtue the Spaniard has instilled in his team. That virtue, simple yet complex, has driven the Premier League race to the last weekend, promising unputdownable drama. This precisely is the virtue that Arsenal didn't carry to the Emirates, buried somewhere in the depths of the glorious Highbury, where it became the Invincibles. The Emirates is a magnificent piece of architecture, a stadium with a soul, yet Arsenal have floundered several years without a league triumph,



The influence of Guardiola is profound on Arteta's tactics, in the use of false nine, possession play, compact midfields, and this season the use of back-four

REUTERS

left to console with their record collection of FA Cups.

Arteta's men, in equal measures gladiatorial, steely and stylish, have restored belief. It begins with Arteta himself, whose career itself is a triumph of self-belief beating rejections. At La Masia, he was always in the shadows of two midfield titans, Xavi and Andres Iniesta. For much of his time at Barcelona, he played in the B team in division two; he was shipped to PSG, Rangers, and Real Sociedad, and he found his feet nowhere.

"I was so disheartened that there were times when I felt football was not meant for me. But I worked really hard to play for a top club," he had once said. Everton was not a top club when he joined them in 2005, nor was Arsenal at their peak when he became a Gunner. But all that defiance—as well as his education under two of the greatest managers of all time, Wenger and Pep Guardiola.—is serving well for him as a manager.

From Wenger, he picked the

importance of identity, the involvement that goes beyond the touchline and board-room, but to immerse himself in every little aspect of the club. He is involved in the appointment of academy coaches. He personally attends the interviews. He felt the presence of a dog would benefit the players to relax during intense training sessions. So he himself handpicked Win, a lab. He cajoled set-piece specialist Nicolas Jover from Manchester City to Arsenal with glorious results. After his inbox was

flooded with fans pushing to make Louis Dunford's 'The Angel' the club's anthem, Arteta espoused their case and the song is belted out before kick-off in every home game. After games, he meets the families of his players in the stadium, shakes their hand, looks them in the eye and gives them a hug and a kiss. The bond spills onto the field. With success, steady and not spontaneous, has somewhat killed the Wenger-nostalgia. Arsenal is a club enjoying their present, and not stuck in their past.

The influence of Guardiola's is profound on his tactics, in the use of false nine, possession play, compact midfields, and this season the use of back-four, comprising more of typical centre-backs rather than flying full-backs, in a bid to counter the counterattacks, which they were vulnerable to last year. Ben White and Tomori Tomiyasu are not full-backs in the Trent Alexander-Arnold—Andy Robertson mould, but they offer immense defensive stability. He has also deployed the box midfield, a midfield with a double pivot and a play-making one. A double-pivot offers good coverage of central areas of the pitch, with either defensive midfielder able to react if the team loses the ball and are stuck in transition.

# Govt mulls anti-fake review rules mandatory for e-commerce firms

**THE GOVERNMENT IS** considering to make it mandatory for e-commerce companies to comply with quality norms for consumer reviews after a voluntary push failed to effectively curb fake reviews, a top official said on Monday.

The government issued the new quality norms for e-tailers a year ago, prohibiting them from publishing paid reviews and demanding disclosure of such promotional content.

But fake reviews of products and services on e-commerce platforms are still slipping through, said Nidhi Khare, secretary at the Consumer Affairs Ministry.

"It's been more than one year that the voluntary stan-



NIDHI KHARE, secretary, consumer affairs ministry

To safeguard the consumer interest, now we want to make these standards mandatory.

dard on 'online reviews' was notified. Some entities claim that they are complying with it. However, fake reviews are still getting published," Khare

told this news agency.

"To safeguard the consumer interest, now we want to make these standards mandatory," she said, adding that the ministry has scheduled a meeting with e-commerce firms and consumer organisations on May 15 to discuss the proposed move.

The ministry's Bureau of Indian Standards (BIS) that formulated and issued the new standard for "Online Consumer Reviews" in November 2022, barred publishing of reviews "purchased and/or written by individuals employed for that purpose by the supplier or third party concerned".

—PTI

# Nisha sees light, with Sakshi steering



Nisha has spent a large part of her life doing everything Sakshi does

MIHIR VASAVDA  
New Delhi, May 13

**BEFORE FRIDAY, THE** night she won a Paris Olympics quota, when Nisha Dahiya last hit the headlines, it was to let the world know she wasn't dead.

Late one evening in November 2021, news began to trickle out in the wrestling circuit that a young woman named Nisha had been shot dead at an akhara in Sonapat. Within minutes, photos of Nisha Dahiya flooded the internet. Above it, a hashtag: 'RIP'.

On Monday, two days after she sealed an Olympic berth

for the country in the 68 kg category at the World Qualifiers, Nisha doesn't dwell much on the time when she had to read her own obits during the bizarre case of mistaken identity, when another unfortunate wrestler lost her life.

But she can't stop talking about the one person who issued statements and made videos to debunk the fake news of her demise — Sakshi Malik. Sakshi would also stand by her during the tougher challenges that followed.

In 2016, after she won the bronze medal at the Rio Olympics, Sakshi broke the proverbial glass ceiling for women wrestlers in India. For

Nisha, she became a lifelong ally, sparring partner, roommate at national camps and a mentor.

"She came into my life at a time when I needed someone to show me the way; to show what's right and wrong," Nisha tells *The Indian Express* from Istanbul, where the qualifying tournament took place.

Nisha was in Class 8 when she left her home in Adiana, Panipat, to pursue a career in wrestling. After a brief stay in Nidani, she moved to Rohtak in 2015 and joined an akhara run by Sakshi's father-in-law. From that moment on, Nisha has spent a large part of her life doing everything Sakshi does.

**XPRO INDIA LIMITED**  
CIN: L25209WB1997PLC085972  
Registered Office: Barjora Meja Road, P.O. - Ghulgoria, Tehsil - Barjora, Dist. - Bankura, West Bengal - 722 202  
Tel.: 91-9775301701; Email: cosec@xproindia.com; Website: www.xproindia.com

**NOTICE**  
**Change in Registrar and Share Transfer Agent (RTA) of the Company**  
Members of Xpro India Limited (the Company) and all other concerned stakeholders are hereby informed that the company has appointed M/s. Link Intime India Private Limited (Link Intime) as its Registrar and Share Transfer Agent in place of M/s. MCS Share Transfer Agent Limited with effect from Monday, May 13, 2024.  
Effective May 13, 2024, all Members, Beneficial Owners and Depository Participants are requested to deliver all requests / documents / correspondence relating to the Company's Equity Shares at the following address:  
**Link Intime India Private Limited**  
Unit : Xpro India Limited  
C 101, 247 Park, L.B.S. Marg, Vikhroli (West), Mumbai - 400083  
Tel : 022-49186270 / 8108116767, Fax : 022-49186060  
Email : mt.helpdesk@linkintime.co.in  
Website : www.linkintime.co.in  
Members of the Company are advised to send all the correspondences and requests including those relating to dividend, transmission of shares, change of address, KYC, loss of share certificates, etc., at the above address.  
Effective from May 13, 2024, the Register of Members is being kept at the Registered Office of the Company.  
By Order of the Board for XPRO INDIA LIMITED  
Kamal Kishor Sewoda  
Company Secretary  
Place : Kolkata  
Date : May 13, 2024

**Notice for Sale of Assets of M/s. ASTER PRIVATE LIMITED**  
Plot No.141/1, Phase-II, IDA, Charlapally, Hyderabad, Telangana-500051.  
Liquidator:- Naren Sheth, Regd. No. IBB/PA-001/IP-P00133/2017-18/10275  
Liquidator Office:- TATA ROAD NO.1, OPERA HOUSE, CHARNI ROAD (EAST), MUMBAI 400004, E-mail: cirp@asterco.in/nvsheth@mkindia.com

**E-Auction (Date & Timings)**  
**Sale of Assets under Insolvency and Bankruptcy Code, 2016**  
**12th June 2024 from 11.00 A.M. to 12.00 P.M.**  
**(With unlimited extension of 5 minutes each)**

Sale of Assets of M/s. ASTER PRIVATE LIMITED (in Liquidation) under Regulation 32(a) to 32 (d) of Insolvency and Bankruptcy Board of India (Liquidation Process) Regulations, 2016, by the Liquidator, appointed by the Hon'ble National Company Law Tribunal, Hyderabad bench vide order in IA (IBC)/259/2021 in CP (IB) No.199/7/HDB/2019 dated 22.09.2021. The sale will be done through the e-auction platform <https://eauctions.co.in>.

**12th June 2024 - Wednesday from 11:00 A.M. to 12:00 P.M.**

Description	Reserve Price INR in Crore	Earnest Money Deposit (EMD) INR in Crore	Bid Increase amount in Crore
Auction timings: 11:00 AM to 12:00 PM. Non-agricultural Land situated at 1 Sy No. 197, 198(P), 207(P) & 251(P) of Bhoopath village, Mahabunagar District, Telangana- 34.3 Acres (Currently leased to ABSPL (Owned by Triumph Global India Pvt Ltd.) until 31.05.38) on a non-cancellable basis)* Only land no other assets	16.40	1.64	0.10

o Last date for submission of Eligibility Documents: 28th May 2024  
o Last date for information sharing, site visit, discussion meetings: 05th June 2024  
o Last date for EMD submission: 10th June 2024

**TERMS AND CONDITION OF THE E-AUCTION ARE AS UNDER:**

- E-Auction will be conducted on "AS IS WHERE IS", "AS IS WHAT IS" AND "WHATEVER THERE IS BASIS" as such sale is without any kind of warranties and indemnities through service provider, M/s Linkstar Infosys Private Limited (<https://eauctions.co.in/>) Contact: Mr. Istihak Ahmed & Mr. Vijay Pipalyaya, E-mail: admin@eauctions.co.in, Contact no. 9870099713
- Bid documents shall be submitted to Liquidator through e-mail: cirp@asterco.in/nvsheth@mkindia.com and also Original hard copy must be sent to Liquidator's Office TATA ROAD NO.1, OPERA HOUSE, CHARNI ROAD (EAST), MUMBAI-400004. The bid form and Process Memorandum containing the detailed terms & conditions of the E-auction process can be downloaded from the website <https://eauctions.co.in/>. E-auction service provider M/s Linkstar Infosys Private Limited, will provide User ID and password for the e-auction, to the qualified bidders for participating in the e-auction.
- The intending bidders, prior to submitting their bid, should make their independent due diligence regarding the corporate debtor, assets, duties, transfer fee, maintenance charges or other taxes/fees charges, if any, and inspect the corporate debtor and its assets at their own expense by contacting the Liquidator or sending an email to cirp@asterco.in.
- The Intending bidders are required to deposit Earnest Money Deposit (EMD) by 10th June 2024 through DD/RTGS/Bank Transfer in the Account of "M/s. Aster Private Limited (Under Liquidation)", having Account having Account No.921020044126539 with Axis Bank, S.R. Nagar, IFSC Code UTIB0000289
- The intending bidder should submit the evidence for EMD deposited along with prescribed bid documents to the liquidator via email to cirp@asterco.in and also submit the hard copy to the above address.
- Liquidator has the right to extend/defer/cancel and/or modify, delete any of the terms and conditions in the Process Memorandum including timelines of E-Auction at his discretion in the interest of Liquidation Process and has right to reject any bid without any prior notice or assigning any reason whatsoever at any stage of the auction.
- If any adjudicator or appellate authority grants an interim stay on the E-Auction, the liquidator will not be held accountable for it and will not be liable for refund of EMD/any losses or damages resulting from the delay.
- Aster private limited entered into a non-cancellable lease agreement Dated 06.10.2023 and amended on 27.08.2019 and possession is not with the Liquidator.
- According to the recent demand from the liquidator regarding the lessee's failure to pay lease rental, the amount owed is Rs.1,79,07,279 (dated 13.05.2024).
- The Office of Commissioner of Boothpur Municipality issued a demand notice dated 08.09.2023 for Rs.10,59,32,349 towards property tax dues (on 101 acres). On the 34.3 acres proportionately, it will come approximately Rs.3,56,60,395.
- According to the NCLT Order in IA.No. 1404/2023, lease hold rights granted to ABSPL are also part of the liquidation estate. However, the petitioner challenged the NCLT order, which was pending for hearing at the NCLAT Chennai bench. The hearing was postponed June 13, 2024 (Appeal No. 125/2024).
- Aster Private Limited has the ownership only on Land and has no other assets (buildings, plants, or machinery) in its name, hence only land is up for auction.
- Liquidator is disclosed all available information about this property as of the Sale notice publishing date; bidders are requested to do their own due diligence, and the liquidator will not be held liable for any subsequent events or occurrences.

CA Naren Sheth  
Liquidator - Aster Private Limited  
Reg.No. IBB/PA-001/IP-P00133/2017-18/10275  
Date: 14th May 2024  
Place: Hyderabad

**INOX India Limited**  
Regd. Office: 9th Floor, K P Platina, Race Course, Vadodara - 390007  
Tel: (+91 265) 6160100. CIN: U99999GJ1976PLC018945,  
Email: secretarial.in@inoxcva.com, Website: www.inoxcva.com

**INOXCVA**  
HISTORICALLY FUTURISTIC

**EXTRACT OF AUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2024**

Rs in Lakhs

Sl No.	Particulars	Quarter ended			Year ended	
		March 31, 2024 (Audited)	December 31, 2023 (Unaudited)	March 31, 2023 (Audited)	March 31, 2024 (Audited)	March 31, 2023 (Audited)
1	Total Income	28,732	29,517	24,178	1,16,249	98,608
2	Net Profit/(Loss) for the period before Tax (Before exceptional Items and/or extraordinary Items)	5,772	6,389	4,103	25,778	20,694
3	Net Profit/(Loss) for the period before tax (After exceptional and/or extraordinary Items)	5,772	6,389	4,103	25,778	20,694
4	Net Profit/(Loss) for the period after Tax (After exceptional and/or extraordinary Items)	4,408	4,859	3,061	19,600	15,474
5	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period after tax and Other Comprehensive Income after tax]	4,234	4,844	3,191	19,403	15,359
6	Paid up Equity Share Capital (Face Value Rs. 2 per share)	1,815	1,815	1,815	1,815	1,815
7	Earning per share (Face value of Rs. 2 per share)*					
	: Basic	4.86	5.35	3.37	21.59	17.05
	: Diluted	4.84	5.34	3.37	21.53	17.05

\*Not annualised

**Notes:**

- The Audited Standalone and Consolidated Financial Results for the Quarter and Year ended March 31, 2024 have been reviewed and recommended by Audit Committee and approved by the Board of Directors at their meetings held on May 13, 2024. The Statutory Auditors of the Company have carried out the audit and have issued their unmodified opinion on the financial statements.
- The above results are an extract of the detailed format of Annual Financial Results filed with the stock exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the audited Quarterly and Yearly Standalone and Consolidated Financial Results are available on the Stock Exchange website ([www.bseindia.com](http://www.bseindia.com) and [www.nseindia.com](http://www.nseindia.com)) and on the Company's website ([www.inoxcva.com](http://www.inoxcva.com)).
- Information on Standalone Financial Results:**

Sl No.	Particulars	Quarter ended			Year ended	
		March 31, 2024 (Audited)	December 31, 2023 (Unaudited)	March 31, 2023 (Audited)	March 31, 2024 (Audited)	March 31, 2023 (Audited)
1	Total Income	28,123	27,945	24,177	1,11,685	96,952
2	Net Profit for the period before tax	5,641	5,905	4,317	24,563	20,842
3	Net Profit for the period after tax	4,295	4,495	3,274	18,613	15,623

**KEY HIGHLIGHTS FOR FY 2024**

- Inauguration of new plant at Savli, Vadodara
- Highest Order Inflow of Rs 1193 Cr.
- Highest Export Revenue of Rs 641 Cr.
- Highest EBITDA of Rs. 282 Cr.
- Listing on Indian Stock Exchanges.
- Highest Order Backlog of Rs 1087 Cr.

On behalf of the Board of Directors For INOX India Limited  
Pavan Kumar Jain  
Chairman  
DIN: 00030098  
Place : Mumbai  
Date : 13th May, 2024

**WELCAST STEELS LIMITED**  
CIN: L27104GJ1972PLC085827  
Regd. Office: 115-116, G.V.M.M. Estate, Odhav Road, Ahmedabad 382 415  
Ph. 079-22901078 Fax: 079-22901077  
Website: www.welcaststeels.com, Email: info@welcaststeels.com

**Audited Financial Results for the Quarter / Year ended 31 March 2024**

(₹ in Lakhs)

Sr No.	Particulars	Quarter Ended		Year Ended	
		31.03.2024	31.03.2023	31.03.2024	31.03.2023
1	Total income from operations	2,562.63	2,137.31	9,107.30	9,391.79
2	Net Profit (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	179.80	(281.21)	700.84	239.58
3	Net Profit (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	179.80	(281.21)	700.84	239.58
4	Net Profit (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	134.53	(209.08)	524.85	264.02
5	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	114.70	(230.94)	516.15	278.87
6	Equity Share Capital	63.82	63.82	63.82	63.82
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year			3967.46	3467.26
8	Earnings Per Share (EPS) (of ₹ 10/- each) (for continuing and discontinued operations)				
	a. Basic & Diluted EPS before Extra ordinary items (in ₹)	21.08	(32.76)	82.24	41.37
	b. Basic & Diluted EPS after Extra ordinary items (in ₹)	21.08	(32.76)	82.24	41.37

**Note:** 1. The above is an extract of the detailed format of Financial Results for the Quarter/Year ended March 31, 2024 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015. The Full format of the Financial Result for the Quarter / Year ended March 31, 2024 are available on the Stock Exchange website ([www.bseindia.com](http://www.bseindia.com)) and Company's website ([www.welcaststeels.com](http://www.welcaststeels.com))  
2. Board of Directors recommends dividend of Rs. 2.50 per Equity Share of Rs. 10 each for the Financial Year 2023-24.  
By Order of Board of Directors For Welcast Steels Limited  
Sd/-  
(D.P. Dhanuka)  
Chairman  
DIN:00168198  
Place: Hyderabad  
Date: 13.05.2024

**WELCAST STEELS LIMITED**  
CIN: L27104GJ1972PLC085827  
Regd. Office: 115-116, G.V.M.M. Estate, Odhav Road, Ahmedabad 382 415  
Ph. 079-22901078 Fax: 079-22901077  
Website: www.welcaststeels.com, Email: info@welcaststeels.com

**Audited Financial Results for the Quarter / Year ended 31 March 2024**

(₹ in Lakhs)

Sr No.	Particulars	Quarter Ended		Year Ended	
		31.03.2024	31.03.2023	31.03.2024	31.03.2023
1	Total income from operations	2,562.63	2,137.31	9,107.30	9,391.79
2	Net Profit (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	179.80	(281.21)	700.84	239.58
3	Net Profit (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	179.80	(281.21)	700.84	239.58
4	Net Profit (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	134.53	(209.08)	524.85	264.02
5	Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	114.70	(230.94)	516.15	278.87
6	Equity Share Capital	63.82	63.82	63.82	63.82
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year			3967.46	3467.26
8	Earnings Per Share (EPS) (of ₹ 10/- each) (for continuing and discontinued operations)				
	a. Basic & Diluted EPS before Extra ordinary items (in ₹)	21.08	(32.76)	82.24	41.37
	b. Basic & Diluted EPS after Extra ordinary items (in ₹)	21.08	(32.76)	82.24	41.37

**Note:** 1. The above is an extract of the detailed format of Financial Results for the Quarter/Year ended March 31, 2024 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015. The Full format of the Financial Result for the Quarter / Year ended March 31, 2024 are available on the Stock Exchange website ([www.bseindia.com](http://www.bseindia.com)) and Company's website ([www.welcaststeels.com](http://www.welcaststeels.com))  
2. Board of Directors recommends dividend of Rs. 2.50 per Equity Share of Rs. 10 each for the Financial Year 2023-24.  
By Order of Board of Directors For Welcast Steels Limited  
Sd/-  
(D.P. Dhanuka)  
Chairman  
DIN:00168198  
Place: Hyderabad  
Date: 13.05.2024

**INOX India Limited**  
Regd. Office: 9th Floor, K P Platina, Race Course, Vadodara - 390007  
Tel: (+91 265) 6160100. CIN: U99999GJ1976PLC018945,  
Email: secretarial.in@inoxcva.com, Website: www.inoxcva.com

**INOXCVA**  
HISTORICALLY FUTURISTIC

**EXTRACT OF AUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2024**

Rs in Lakhs

Sl No.	Particulars	Quarter ended			Year ended	
		March 31, 2024 (Audited)	December 31, 2023 (Unaudited)	March 31, 2023 (Audited)	March 31, 2024 (Audited)	March 31, 2023 (Audited)
1	Total Income	28,123	27,945	24,177	1,11,685	96,952
2	Net Profit for the period before tax	5,641	5,905	4,317	24,563	20,842
3	Net Profit for the period after tax	4,295	4,495	3,274	18,613	15,623

**KEY HIGHLIGHTS FOR FY 2024**

- Inauguration of new plant at Savli, Vadodara
- Highest Order Inflow of Rs 1193 Cr.
- Highest Export Revenue of Rs 641 Cr.
- Highest EBITDA of Rs. 282 Cr.
- Listing on Indian Stock Exchanges.
- Highest Order Backlog of Rs 1087 Cr.

On behalf of the Board of Directors For INOX India Limited  
Pavan Kumar Jain  
Chairman  
DIN: 00030098  
Place : Mumbai  
Date : 13th May, 2024

